

આ અઠવાડિયાની મુનાસેબત

૨૦ જ.આખર - વિલાદતે જનાબે ફાતેમા ઝહરા^(સ.અ.)

૨૧ જ.આખર - શહાદતે જનાબે ઉમ્મે કુલસુમ^(સ.અ.)

વિલાદતે જનાબે ફાતેમા ઝહરા^(સ.અ.)

જનાબે ઝહરા^(સ.અ.)ની બાઅઝમત વિલાદત બાસઅદતના મૌકા ઉપર આવો આપણે તેમના ફરઝંદ ઈમામ મહદી^(અ.ત.ફ.શ.) કે જેઓ યુસુફે ઝહરા છે તેમની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ.

ખુદાવંદે આલમે એહલેબૈત^(અ.મુ.સ.)ને એક 'નુર' થી પૈદા કર્યા છે અને એહલેબૈત^(અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સિક્કતો અને ખૂબીઓમાં એકબીજાથી મળતી આવે છે. બધાજ અદ્લાહના ચુંટાયેલા માસુમ અને રહેનુમા છે. જનાબે ઝહરા^(સ.અ.)ની પાસે ઈમામ મહદી^(અ.ત.ફ.શ.)ની અઝમત અને મહત્વ કંઈક અલગ છે.

ખુદાવંદે આલમે જયારે જિબ્રઈલ^(અ.સ.) થકી હઝરત રસૂલેખુદા^(સ.અ.વ.)ને ઈમામ હુસૈન^(અ.સ.)ની શહાદતથી માહિતગાર કર્યા અને જયારે હઝરત રસૂલેખુદા^(સ.અ.વ.)એ આ ખબર જનાબે ફાતેમા ઝહરા^(સ.અ.)ને સંભળાવી તો આપ^(સ.અ.)ને ખૂબજ દુઃખ થયું અને જયારે જિબ્રઈલ^(અ.સ.) આ પૈગામ લઈને આવ્યા કે જનાબે ઝહરા^(સ.અ.)ને કહો કે અદ્લાહે ઈમામતને તેમના વંશમાં રાખી છે અને તેમના વંશમાંથી જ મહદી^(અ.ત.ફ.શ.) હશે, જેમની પાછળ હઝરત ઈસા^(અ.સ.) નમાઝ પઢશે અને તે તમારા હુસૈન^(અ.સ.)ના ખુનનો બદલો લેશે. આ સાંભળી જનાબે ઝહરા^(સ.અ.)ના દિલને સુકુન મળ્યું.

તેથી જયારે જયારે જનાબે ઝહરા^(સ.અ.)એ હઝરત રસૂલેખુદા^(સ.અ.વ.)ના પછી જે મુસીબતોનો સામનો કર્યો તેમાં આપ^(સ.અ.)એ દરેક વખતે ઈમામ મહદી^(અ.ત.ફ.શ.)ને યાદ કર્યા છે અને તેમના ઝિક્રએ બીબીના દિલને શાંતી આપી છે.

બીબી^(સ.અ.) ની વિલાદતનો મુબારક મૌકો આવી રહ્યો છે અને આજે જુમ્બાનો દિવસ પણ છે, તો આવો આપણે પણ ઝમાનાના ઈમામ^(અ.ત.ક.શ.) નો ઝિક્ર કરીએ અને બીબી^(સ.અ.) ના દિલને સુકુન પહોંચાડીએ.

ઈમામ મહદી^(અ.ત.ક.શ.) નો ઝિક્ર

ઝમાનાના ઈમામ^(અ.ત.ક.શ.) નો આપણે શું ઝિક્ર કરીએ? આપણે શું યાદ કરીએ? ઈમામ^(અ.ત.ક.શ.) ખુદ ફરમાવે છે કે :

“ઈન્ના ગયરો મોહમેલીના લે મુરાઆતેકુમ વલા નાસીના લે ઝીક્રેકુમ”

“અમે તમારા કાર્યોથી ગાફિલ નથી

તેમજ તમારી યાદને ક્યારેય ભુલતા નથી.”

વાકેઅન અઝીઝો! આપણે ખુશનસીબ છીએ કે આપણને એવા અઈમ્માહ^(અ.મુ.સ.) મળ્યા છે કે જે આપણને ક્યારેય ભૂલતા નથી, આપણને ક્યારેય પણ એકલા છોડતા નથી.

અઝીઝો ! આજે આપણા ઈમામ^(અ.ત.ક.શ.) ગયબતમાં છે તેનો મતલબ હરગિઝ એમ નથી કે તેઓ આપણાથી ગાફિલ (અજાણ) છે. તેઓ હર હમેંશા આપણી સાથે જ છે. તેથી આપણી પણ જવાબદારીમાંથી છે કે આપણે ઈમામ^(અ.ત.ક.શ.) ને યાદ કરીએ. ઈમામ^(અ.ત.ક.શ.) આપણી યાદના મોહતાજ નથી.

જેવી રીતે હદીસોમાં મળે છે કે ‘ઈમામ^(અ.ત.ક.શ.) ની મિસાલ ખાના-એ-કાબા જેવી છે, ખાના-એ-કાબા લોકોના ઘરે નહી આવે, પરંતુ લોકોની એ જવાબદારી છે કે તેઓ ખાના-એ-કાબા સુધી જાય.’

એવી જ રીતે ઈમામ^(અ.ત.ક.શ.) ને આપણી જરૂર નથી, પરંતુ આપણને ઈમામ^(અ.ત.ક.શ.) ની જરૂર છે અગર આપણે ઈમામ^(અ.ત.ક.શ.) ને યાદ ન કરીએ તો તેમને કોઈ ફર્ક નથી પડવાનો, પરંતુ જો આપણે ઈમામ^(અ.ત.ક.શ.) ને યાદ કરીશું, તેમનો ઝિક્ર કરશું તો આપણા માટે નજાત છે.

ઈમામ^(અ.ત.ક.શ.) ને યાદ કરવા, તેમનો ઝિક્ર કરવો, આપણી ઈમામ^(અ.ત.ક.શ.) પ્રત્યેની લાગણી અને મોહબ્બતને જાહેર કરે છે.

એહલેબૈત^(અ.મુ.સ.) ને યાદ કરવાના ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે આપણે શૈતાનના વસવસાથી મહેફૂઝ રહેશું.

એક બુઝુર્ગ આલીમે દીન પોતાના શાગીર્દોને કહેતા હતા કે શૈતાન આપણી કરતા વધારે હોશિયાર છે. તેણે અદ્દાહને વાયદો કર્યો છે કે તે બની આદમને બહેકાવશે અને આ માટે તે અલગ-અલગ તરીકાઓ અપનાવે છે. આ શૈતાની જાળમાંથી બચવાનો સૌથી આસાન અને વધારે કામિયાબ તરીકો એ છે કે આપણે આપણી અને શૈતાનની વચ્ચે એહલેબૈત^(અ.મુ.સ.) ની યાદને ઢાલ બનાવીએ. કારણ કે શૈતાન તે લોકોથી દૂર રહે છે જેઓ એહલેબૈત^(અ.મુ.સ.) ની યાદમાં મશગુલ હોય છે.

ઈમામ^(અ.ત.ફ.શ.) ની યાદ

આપણે ઈમામ^(અ.ત.ફ.શ.) ને યાદ કરવાનું મહત્વ અને તેના ફાયદાઓ જોયા. હવે આપણે ઈમામ^(અ.ત.ફ.શ.) ને કેવી રીતે યાદ કરવા તે જોઈએ? તે બાબતની ઈમામ સાદિક^(અ.સ.) ની એ હદીસ જોઈએ જે તેઓ તેમના મશહુર સહાબી દાઉદ બિન સરહાનને ફરમાવે છે :

“અય દાઉદ ! મારા સલામ અને મારો પયગામ એ શિયાઓ સુધી પહોંચાડી દ્યો કે જ્યારે બે વ્યક્તિઓ આપસમાં મળે અને અમારી હદીસોની ચર્ચા કરે તો અદ્દાહ તે બંને ઉપર રહેમત મોકલે છે અને તે બંને દરમિયાન ત્રીજો વ્યક્તિ એક ફરિશ્તો હોય છે કે જે તે બંને માટે ઈસ્તગફાર કરે છે. કોઈપણ બે વ્યક્તિ આપસમાં મળી અને અમારો ઝિક્ર નથી કરતા, સિવાય કે અદ્દાહ ફરિશ્તાઓ સમક્ષ આ બાબતે ફખ્ર કરે છે.”

ત્યારબાદ ઈમામ^(અ.સ.) ફરમાવે છે “હું તમને હુકમ આપું છું કે જ્યારે પણ તમે આપસમાં મળો તો અમારી યાદમાં મશગુલ રહેજો. આ અમારી યાદ અમારા અમ્રોને જીવંત કરે છે. અમારી પછી શ્રેષ્ઠ લોકો એ છે કે જેઓ અમારી હદીસોને બયાન કરે છે અને લોકોને અમારી તરફ દરખાવ આપે છે.”

ઈમામ મુસએ કાઝીમ^(અ.સ.) ની હદીસમાં જોવા મળે છે કે જ્યારે એક શખ્સે આપ^(અ.સ.) ને પૂછ્યું કે “શું તમારામાંથી બારમાં ગયબતમાં જશે?” ત્યારે

ઈમામ^(અ.સ.)એ ફરમાવ્યું “હા, જાહેરી રીતે તો તેઓ ગયબતમાં હશે, પરંતુ મોઅમીનોના દિલો તેમની યાદથી ખાલી નહી હોય.”

આ હદીસમાં આપ^(અ.સ.)એ ઈમામ^(અ.ત.ફ.શ.)ને હંમેશા યાદ કરવાના મહત્વ તરફ ઈશારો કર્યો છે.

અઝીઝો ! જ્યારે કોઈને યાદ કરવાની વાત આવે તો આપણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ હઝરત યાકુબ^(અ.સ.)છે કે જેઓ હઝરત યુસુફ^(અ.સ.)ની યાદમાં બેચેન હતા. તેઓ હરહંમેશ ફક્ત પોતાના જુદા પડેલા ફરઝંદ યુસુફ^(અ.સ.)ને યાદ કરતા રહેતા અને આપે એટલું રૂદન કર્યું કે આપની આંખની રોશની ચાલી ગઈ. તેઓ યુસુફ^(અ.સ.)ને યાદ કરીને કહેતા હું તમને ખૂબજ વધારે ચાહતો પરંતુ હવે તમે મારી નઝરોથી ઓજલ થઈ ગયા છો, આ એક મોહિબની પોતાના મહેબુબ પ્રત્યેની યાદ અને તડપ છે.

અઝીઝો ! શું વાકેઅન આજે આપણે ઈમામ^(અ.ત.ફ.શ.)ને આવી રીતે યાદ કરીએ છીએ.

જુમ્આના દિવસે સવારના શું આપણે બેચેન થઈએ છીએ કે આપણા ઝમાનાના ઈમામ^(અ.ત.ફ.શ.) આપણી દરમિયાન મૌજૂદ નથી ? શું આપણે દુઆએ નુદબા પઢીએ છીએ ?

અઝીઝો! આપણે તો નહી પણ જનાબે ઝહરા^(સ.અ.) જરૂર યુસુફે ઝહરાને યાદ કરે છે. આજે પણ તેમની કબ્ર મુબારકથી ‘યા મહદી’ની અવાજ આવી રહી છે.

આવો! આપણે પણ જનાબે ઝહરા^(સ.અ.)નો વાસ્તો આપીને દુઆ કરીએ કે અલ્લાહ આપણને ઈમામ^(અ.સ.)ને યાદ કરવાની અને તેમનો ઝિક્ર કરવાની તૌફીફ આપે અને તેમના ઝહુરમાં જલ્દી કરે અને આપણને બધાને ઈમામ^(અ.ત.ફ.શ.)ના ખાદીમોમાં શુમાર કરે.

પ્રકાશક : હાજીનાજી મેમોરિયલ ટ્રસ્ટ

વેબસાઈટ : www.hajinaji.com ઈમેલ : hajinajitrust@gmail.com